

પાન મસાલા તથા ટોબેકોની બનાવટોની વારંવાર ચોરીઓ કરતા બે રીઠા ચોર ઈસમને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરતી સુરત શહેર વરાછા પોલીસ

સુરત શહેરના વરાછા પો.સ્ટે. વિસ્તારના ફરીયાદી ધર્મેશભાઈ મનજીભાઈ ડાંખરા ઉ.વ.૩૬ ધંધો-વેપાર રહે.૨૬, નંદપાર્ક સોસાયટી એ.કે.રોડ વરાછા, સુરત. મુળવતન- તગડીગામ તા.ઘોઘા જી. ભાવનગરનાઓ તેમની મો.સા. પર ટોબેકો તથા અલગ-અલગ પાન મસાલા રાખીને વેચવા સાડૂ ઘરેથી નીકળેલ અને વરાછા કમલાબાગ એસ્ટેટના ગેટ પાસે આવેલ ઓમ સાઈં પાનના ગલ્લા સામે પોતાની મો.સા. પાર્ક કરીન રાખેલ ત્યારે ફરીયાદીશ્રીની મો.સા. પર રાખેલ વિમલના ૪૦ પાઉચ વાળી થેલી કોઈ ઈસમો ચોરી કરી લઈ ગયેલ હોય, જે બાબતે વરાછા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૦૦૩૫૫/૨૦૨૦ ઈ.પી.કો. કલમ-૩૭૯, ૧૪૪ મુજબનો ગુનો નોંધાયેલ સદર ગુનાના આરોપીઓને શોધી કાઢવા સાડૂ પો.સ.ઈ. શ્રી એ.કે.દેસાઈ તથા બીજા પોલીસ માણસોએ રસ્તા પરના સી.સી.ટી.વી. ફુટેજો દ્વારા આરોપી તથા તેની પાસેની રજી.નં.GJ-05-SL-4885 ની એક્ટીવા મોપેડની ઓળખ કરીને તેની તપાસમાં હતા તે દરમ્યાન અ.હે.કો. સુરેશભાઈ સવજીભાઈ બ.નં.૧૯૬ તથા અ.પો.કો. સંદિપભાઈ ગોવિંદભાઈ પાંદડીયા બ.નં. ૧૨૮૭ નાઓની બાતમીના આધારે વરાછા ફુલ માર્કેટ બ્રીજની નીચેથી રજી. નં.GJ-05-SL-4885 ની એક્ટીવા મોપેડ પર બેસીને પસાર થતા હતા તે દરમ્યાન આરોપી (૧) દર્શનભાઈ રમેશભાઈ ઉનાગર ઉ.વ. ૧૮ વર્ષ ૦૯ માસ રહે.૧૪૮, શીવછાયા સોસા., અવધુતનગર વાડીલાલ ચાર રસ્તા કતારગામ, સુરત. મુળગામ. ભારવઢ તા.મહુવા જી.ભાવનગર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરને પકડી પાડી વરાછા પો.સ્ટે. લઈ આવી તેની વધુ પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, તેઓ આ અગાઉ પણ ફરીયાદી શ્રીની મો.સા. પરથી કતારગામ નંદુડોશીની વાડી પાસેથી ભોલે પાન સેન્ટર ખાતેથી એક થેલો ચોરી કરેલ હતો જે થેલામાંથી બાગબાન તમાકુ તથા રજનીગંધા પાન મસાલાના ત્રણ પેકેટ તથા જફરીપાન મસાલાનું એક પેકેટ તથા કમલા પસંદ પાન મસાલાનું એક પેકેટ તથા તાનસેન પાન મસાલાના છ પેકેટ મળી આવેલ સદર પાન મસાલાની વસ્તુઓ ચોરી થવા બાબતે કતારગામ પો.સ્ટે. ફ્રસ્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૦૦૧૯૧/૨૦૨૦ ઈ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયેલ હોય સદર ગુનાના મુદ્દામાલ આરોપીએ કતારગામ આંબાતલાવડી ખાતે અપના અડ્ડા નામના પાનના ગલ્લામાં વેચેલ હોવાનું જણાવતા વરાછા પોલીસના પોલીસ માણસોએ કતારગામ ખાતેથી અપના અડ્ડા પાનના ગલ્લા ખાતેથી તેના માલીક મિલનભાઈ ભરતભાઈ ચોવટીયા રહે. બી/૪૦૩, ગૃહમ સોસાયટી છાપરાભાઠા, વરીયાવ અમરોલી, સુરત. મુળગામ. જસદરાણ તા.જસદરાણ જી.રાજકોટ નાઓ પાસેથી ઉપરોક્ત ગુનાના કામનો ખરીદ કરેલ મુદ્દામાલ કબ્જે કરી આરોપીની વધુ પુછપરછ કરી તપાસ કરતા આરોપી દર્શનભાઈ રમેશભાઈ ઉનાગર ઉ.વ. ૧૮ વર્ષ ૦૯ માસ રહે.૧૪૮, શીવછાયા સોસા., અવધુતનગર વાડીલાલ ચાર રસ્તા કતારગામ, સુરત. મુળગામ.ભારવઢ તા.મહુવા જિ.ભાવનગર અમદાવાદ માધવપુરા પો.સ્ટે. થી પાસામાં વોન્ટેડ છે. શોધી કાઢેલ ગુના :- (૧) વરાછા પો.સ્ટે. ફ્રસ્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૦૦૩૫૫/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ (૨) કતારગામ પો.સ્ટે. ફ્રસ્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૦૦૧૯૧/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ (૩) અમાદાવાદ પો.સ્ટે. પાસામાં વોન્ટેડ.

ગુનાહીત ઈતિહાસ (૧) કતારગામ પો.સ્ટે. ફ્રસ્ટ ગુ.ર.નં.-૨૭૬/૨૦૧૭ રૂ.૨૭,૦૪૦/- મુદ્દામાલ
(૨) કતારગામ પો.સ્ટે. ફ્રસ્ટ ગુ.ર.નં.૧૨૮/૨૦૧૮ રૂ.૨૨,૭૫૦/- મુદ્દામાલ (૩) ગાંધીનગર પો.સ્ટે. ફ્રસ્ટ ગુ.ર.નં. ૯૩/૨૦૧૯ રૂ.૧૦ લાખનો મુદ્દામાલ (૪) રાંદેર પો.સ્ટે. ફ્રસ્ટ ગુ.ર.નં.૧૧૦/૨૦૧૯ રૂ.૩૭,૨૬૦/-નો મુદ્દામાલ (૫) અમદાવાદ માધવપુરા પો.સ્ટે. ફ્રસ્ટ ગુ.ર.નં.૧૩૭/૨૦૧૯ રૂ.૧,૭૬,૦૦૦/- નો મુદ્દામાલ (૬) વરાછા પો.સ્ટે. ફ્રસ્ટ ગુ.ર.નં. ૧૮૯/૨૦૧૯ રૂ.૨૭,૦૪૦/- નો મુદ્દામાલ.